

ધી સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ., હિંમતનગર.

સ્ટેશન રોડ, હિંમત હાઈસ્કૂલ સામે

શાખા _____

તારીખ _____

:: નોન ફાર્મ સેક્ટર હેઠળ ધંધા / ઉદ્યોગના વિકાસ અર્થે નવા ક્ષેત્રોમાં

લોન મેળવવા માટેનું અરજીપત્રક ::

(અરજી બે નકલમાં રજુ કરવી)

પ્રતિ,

શ્રી ચીફ એક્ઝીક્યુટીવ સાહેબ,

ધી સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ.,

હિંમતનગર.

અરજદારનો
ફોટો

મહેરબાન સાહેબ,

હું / અમો આપની બેંક પાસેથી ધંધા / ઉદ્યોગના વિકાસ અર્થે

.....હેતુ માટે રા.

(અંકે રૂપિયા) ની નોન ફાર્મ સેક્ટર હેઠળ

નવા ક્ષેત્રોમાં લોન મેળવવા માટે અરજી કરું છું / કરીએ છીએ. જે અન્વયે નીચેની માહિતી પુરી પાડું છું / પાડીએ છીએ.

૧. ઔદ્યોગિક એકમ પેઢીનું નામ : મેસર્સ _____ (ધંધાની ગ્રામ પંચાયત,

નગરપાલિકામાં નોંધણી કરાવેલ હોય તો રેકર્ડની નોંધ નંબર અને પુરાવા સહિતની વિગત આપવી)

૨. (અ) અરજદારનું નામ શ્રી _____ ઉંમર _____ વર્ષ જાતના _____

(બ) રહેઠાણનું સરનામું : _____

_____ ફોન નં. _____ મો.નં. _____

(ક) ધંધાનું સરનામું : _____

_____ ફોન નં. _____ મો.નં. _____

(ડ) અરજદારની શૈક્ષણિક - તાંત્રિક લાયકાત અને અનુભવની વિગત (પ્રમાણપત્રો સામેલ કરવા) : _____

૩. ધંધાની સ્થાપનાની તારીખ સહિત વિગત તથા લાઈસન્સ, નોંધણી વિગેરેની માહિતી તેમજ ધંધા / ઉદ્યોગની રૂપરેખા

તથા ઔદ્યોગિક પ્રવૃત્તિનું ટુકું વર્ણન : _____

૪. અરજદાર એકમ / પેઢીનું બંધારણ : _____

(વ્યક્તિ / પ્રાપ્રાયટરશીપ / પાર્ટનરશીપ પેઢી / ખાનગી-જાહેર લીમીટેડ કંપની)

(અ) વ્યક્તિ / પ્રોપ્રાયટરશીપ હોય તો

વ્યક્તિ / પ્રોપ્રાયટરનું નામ, સરનામું અને ફોન નંબર	ઉંમર વર્ષ	ભણતર-ધંધાનો અનુભવ	મિલ્કતની વિગત (પુરાવા રજૂ કરવા)

(બ) પાર્ટનરશીપ પેટી / ખાનગી-જાહેર લીમીટેડ કંપની હોય તો -

રજીસ્ટ્રેશન નંબર તારીખ

અ. નં.	ભાગીદાર / ડીરેક્ટરનું નામ, સરનામું અને ફોન નંબર	ઉંમર વર્ષ	ભણતર-ધંધાનો અનુભવ	મિલ્કતની વિગત (પુરાવા રજૂ કરવા)
૧				
૨				
૩				
૪				
૫				

(૫) એકમ / પેટીની શાખાઓ તથા સમાનહિત ધરાવતા એકમ / પેટીના નામ, તેના ધંધાનો પ્રકાર અને સરનામાની વિગતો તથા આવા દરેક એકમ / પેટી કે શાખા સાથે સામાન્ય રીતે સંકળાયેલ હોય તેવા માલિક / ડીરેક્ટરના નામ વિગેરેની વિગતો : _____

(૬) અરજદાર આ બેંક અગર અન્ય કોઈ બેંક / સંસ્થામાં જામીન તરીકે કે વ્યક્તિગત હેસીયતથી અન્ય કોઈ જવાબદારી ધરાવતા હોય તો તેની વિગત : _____

(૭) માંગેલ ધિરાણ ઉપરાંત આ બેંક અથવા અન્ય કોઈ બેંક / સંસ્થામાંથી ધિરાણ લીધું હોય તો તેની વિગતો (બેંક, શાખાનું નામ, સરનામું વિગેરેની વિગત તથા દાખલો રજૂ કરવો) : _____

(૮) અરજદાર જો આ બેંકમાં ખાતું ધરાવતા હોય તો -

શાખા _____ ખાતાનો પ્રકાર _____ ખાતા નંબર _____
સેવિંગ્સ / કરંટ ખાતુ હોય તો વાર્ષિક ટર્ન ઓવર _____

(૯) લોનનો હેતુ : _____

(૧૦) લોનની માંગણી : મૂડી ખર્ચ માટે ટર્મ લોન રૂ. _____

વર્કિંગ કેપીટલ માટે લોન રૂ. _____

કુલ લોન રૂ. _____

(૧૧) ખરીદવાની અસ્કયામતની વિગત (વધુ માહિતી એનેક્સર-૫ માં ભરવી) :

(અ) અસ્કયામતનું નામ, વર્ણન અને તેની કિંમતની વિગત (આઈ.એસ.આઈ. માર્કના સાધનોને પ્રાથમિકતા આપવાની રહેશે) : _____

(બ) જે ડીલરને ત્યાંથી સાધન ખરીદ કરવાના હોય તેનું નામ અને સરનામું (સેલ્સટેક્સ નંબર ધરાવતા સપ્લાયરના જ ક્વોટેશનો સામેલ કરવા) : _____

(ક) સાધન ઓપરેટ કરનારનું નામ અને તેની ટેકનીકલ જાણકારીની વિગત : _____

(૧૨) એકમ / પેટીના વેપાર / ધંધા અંગેની છેલ્લા ૩ વર્ષની માહિતી (સરવૈયાની નકલ સામેલ કરવી) : (રકમ રૂ.)

અ.નં.	વિગત	વર્ષ	વર્ષ	વર્ષ
૧.	ખરીદી			
૨.	વેચાણ			
૩.	ચોખ્ખો નફો નુકશાન			
૪.	સેલ્સટેક્સની ભરેલી રકમ			
૫.	ઈન્કમેટેક્સની ભરેલી રકમ (આકારણીની નકલ સામેલ કરવી)			
૬.	મિલકત ટેક્સની ભરેલી રકમ (આકારણીની નકલ સામેલ કરવી)			

(૧૩) એકમ / પેટીની છેલ્લાં વર્ષની આર્થિક પરિસ્થિતિ દર્શાવતું તારીખના રોજનું પાકું સરવૈયું
(જો સરવૈયું છ માસ જુનું હોય તો પ્રોવિઝનલ સરવૈયું રજુ કરવું)

પુંજી - દેવા	રકમ રૂ.	મિલકત - લેણાં	રકમ રૂ.
મુડી		સ્થાયી મિલકત	
અન્ય ભંડોળ		મકાન / ગોડાઉન	
સગાસંબંધીની થાપણ		ડેડ સ્ટોક	
બહારનું કર્જ		ઉધરાણી	
બેંકનું કર્જ		અન્ય લેણાં	
વેપારી દેવું		માલસ્ટોક	
અન્ય દેવું		બેંક બેલેન્સ અને પુરાંત	
અન્ય		અન્ય	
કુલ		કુલ	

(૧૪) મકાન, ડેડસ્ટોક, માલસ્ટોક વિગેરેનો વીમો ઉતારાયેલ હોય તો વીમાની રકમ, મુદત અને આવરી લીધેલ જોખમ સહિતની વિગતો : _____

(૧૫) અરજદાર કે તેમના કુટુંબના સભ્યોના નામે જો કોઈ સ્થાવર મિલ્કત હોય તો તેની વિગતો (પુરાવા રજુ કરવા) _____

(૧૬) બેંકને વધારાની જામીનગીરી (કોલેટરલ સીક્યુરીટી) તરીકે આપવાની અસ્ક્યામતની વિગત (પુરાવાઓ સામેલ કરવા) : _____

(૧૭) એકમ / પેઢી તથા જામીનોની ઓળખાણ આપનારનું નામ : શ્રી _____

સરનામું : _____

ઘંઘો : _____

સહી : _____

(૧૮) ઘંઘા / ઉદ્યોગના વિકાસ અર્થે નવા સાધનો વસાવ્યા બાદ ઘંઘાની નફાકારકતા, કેશ ફ્લો, બ્રેકફવન પોઈન્ટ અને ડેબ્ટ સર્વિસ કવરેજ રેશીઓના અનુક્રમે એનેક્સર - ૧,૨,૩ અને ૪ આ સાથે સામેલ કરેલ છે.

હું / અમો આથી કબુલાત આપું છું / આપીએ છીએ કે તમો બેંક પાસેથી મેળવેલી લોનમાંથી જે માલ મિલકતો ઉભી કરીશ તે બેંકને નજર તારણ / કબજા તારણ / ગીરોમાં જામીનગીરી તરીકે તારણમાં આપવા સંમત છું / છીએ. આ ઉપરાંત મુદ્દા નં. ૧૬ માં દર્શાવેલ મિલકત વધારાની જામીનગીરી તરીકે બેંકને તારણમાં આપવા રાજી છું / છીએ. તથા ધિરાણની સફ્ફરતા માટે અમો બેંકને નીચે જણાવેલ વ્યક્તિઓની જામીનગીરી આપું છું / આપીએ છીએ. જે માટે તેઓએ અલગ સંમતિપત્ર સહી કરી આપેલ છે. તથા બેંકના દસ્તાવેજો સહી કરી આપવા માટે સંમતિ દર્શાવેલ છે તથા હું / અમો લોન લેનાર જો બેંકના નાણાં પરત ભરપાઈ કરવામાં કસુર કરું / કરીએ તો બેંક જામીનદારો પાસેથી નાણાં વસુલ લેશે એવી કબુલાત પર જામીનદારોએ સહી કરી આપેલ છે. જેઓ બેંકના નોમીનલ સભાસદ થવા સંમત છે. જામીનદારોની મિલકતના તથા આવકના દાખલા પર સામેલ છે. આથી મારા નીચે જણાવેલ બંને જામીનોને માન્ય રાખવા વિનંતી છે.

જામીનોના નામ, સરનામાં અને ઘંઘાની વિગત :

જામીન નં. ૧ નામ શ્રી _____

રહેઠાણનું સરનામું : _____

ઘંઘો : _____ ઘંઘાનું સરનામું : _____

જામીન નં. ૨ નામ શ્રી _____

રહેઠાણનું સરનામું : _____

ઘંઘો : _____ ઘંઘાનું સરનામું : _____

હું / અમો આથી બેંકના પેટાકાયદા અને દિરાણ અંગેના નિયમો વિગેરે હાલમાં જે અમલમાં છે અને જે હવે પછી અમલમાં મુકવામાં આવે તે તમામ પાળવા માટે બંધાઉં છું / બંધાઈએ છીએ.

હું / અમો આથી પ્રમાણપત્ર આપું છું / આપીએ છીએ કે -

- (૧) મેં / અમોએ જે માહિતી ઉપર રજુ કરેલ છે તે તમામ માહિતી ખરેખરી અને સાચી છે.
- (૨) મારા / અમારા ઇંદા / વેપાર માટે હાલમાં કોઈ બેંક સાથે કરજ મેળવવા અંગેની ગોઠવણ નથી.
- (૩) મારી / અમારા સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થયેલ નથી કે હાલ તેવી કોઈ કાર્યવાહી મારી / અમારી સામે ચાલતી નથી.
- (૪) મારી / અમારી આ કરજ મેળવવાની અરજીના સંદર્ભમાં આપને અન્ય કોઈ માહિતીની જરૂર પડશે તે તમામ માહિતી હું / અમો આપને પુરી પાડીશ / પાડીશું અને તેવી માહિતી આપને યોગ્ય લાગે તેવી સંસ્થા કે એજન્સી કે બેંક સાથે આપ લે કરી શકશો.
- (૫) આપ આપની બેંકના પ્રતિનિધિઓ, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, એસ.આઈ.ડી.બી.આઈ., ધી ગુજરાત સ્ટેટ કો-ઓ. બેંક લિ. અને / અથવા આપના અગર આગળ જણાવેલ બેંકો તરફથી અધિકૃત કરવામાં આવેલ અન્ય કોઈ એજન્સીના પ્રતિનિધિઓ કોઈપણ સમયે મારા / અમારા ઇંદાના સ્થળે અમારી મિલ્કતો અને જમીનગીરીઓની અને અમારા હિસાબી ચોપડાઓની તપાસણી કરી શકશો.

- બિડાણ :**
૧. જામીનોનો સંમતિપત્ર
 ૨. એનેક્સર ૧,૨,૩,૪ અને ૫
 ૩. સાધનિક પેપર્સ

સ્થળ : _____

તારીખ : _____

(અરજદારની સહી / સહીઓ)

:: જામીનોનો સંમતિપત્ર ::

પ્રતિ,
શ્રી ચીફ એક્ઝીક્યુટીવ સાહેબ,
ધી સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિ.,
હિંમતનગર.

સવિનય જણાવવાનું કે, અરજદારશ્રી / મેસર્સએ આપની બેંકમાંથી રૂ. ની લોનહેતુ માટે કરજે લેવાની આ સાથે કરેલી અરજીમાં અમારા નામ, અમારી નીચે જણાવેલી વિગતે તેઓના જામીન તરીકે સુચવ્યા છે. તે હમોને કબુલ મંજૂર છે. હમારી સ્વતંત્ર માલિકીના મિલ્કત / મિલ્કતો અંગેની વિગત નીચે પ્રમાણે છે જેની સરકારી દફતરે થયેલ નોંધની નકલો આ સાથે રજુ કરી છે.

જામીન નં. ૧ : નામ શ્રી _____ ઉંમર વર્ષ _____ જાતના _____
રહેઠાણનું સરનામું _____
ઘંઘો _____ ઘંઘાનું સરનામું _____
વાર્ષિક આવક (પુરાવા રજુ કરવા) રૂ. _____
જમીન મિલ્કતની વિગતો (પુરાવા રજુ કરવા) _____

જામીન નં. ૨ : નામ શ્રી _____ ઉંમર વર્ષ _____ જાતના _____
રહેઠાણનું સરનામું _____
ઘંઘો _____ ઘંઘાનું સરનામું _____
વાર્ષિક આવક (પુરાવા રજુ કરવા) રૂ. _____
જમીન મિલ્કતની વિગતો (પુરાવા રજુ કરવા) _____

અમો જામીનો તરીકે જ્યાં સુધી રૂ.ની લોનની કરજ સવલત વ્યાજ સહિત પૂરેપૂરી ભરપાઈ થાય નહીં ત્યાં સુધી ચાલુ રહેવા કબુલ થઈએ છીએ, કરજદાર લોનના નાણાં નિયમીત બેંક લોનમાં ભરપાઈ કરે છે કે નહીં તેની અમો તપાસ કરતા રહીશું અને લોનના હપ્તા ભરપાઈ કરાવવાની અમો તકેદારી રાખીશું તેમ છતાં જો બેંકમાં નાણાં સમયસર ભરપાઈ કરવામાં કસુર થાય તેવા સંજોગોમાં બેંક તેના બાકી હપ્તાના નાણાં વ્યાજ સહિત અમો જામીન પાસેથી વસુલ લઈ શકે તેવી લેખીત કબુલાત કરીએ છીએ. આ લોન અરજી મંજૂર થયા પૂર્વે જામીન આપીએ છીએ કે લોન મંજૂર કર્યા બાદ જ દસ્તાવેજો અરજદારો વિગેરે પાસેથી લખવાના હોય તે જામીન આપવા માટે સંમત થઈએ છીએ.

જામીન નં. ૧ નો
ફોટો

જામીન નં. ૨ નો
ફોટો

(જામીન નં. ૧ ની સહી)

તારીખ : _____

(જામીન નં. ૨ ની સહી)

:: અનેક્ષર - ૧ ::**:: અંદાજીત ઉત્પાદન, વેચાણ અને વાર્ષિક નફાકારકતાનું પત્રક ::****ઈન્સ્ટોલ કેપેસિટીએ ઉત્પાદનની વિગત :****(રકમ રૂ.)**

વિગત	પહેલું વર્ષ	બીજું વર્ષ	ત્રીજું વર્ષ	ચોથું વર્ષ	પાંચમું વર્ષ
● ઈન્સ્ટોલ કેપેસિટી					
● પ્લાન્ટ કેપેસિટીનો ઉપયોગ					
કામના દિવસો					
દરેક દિવસની પાળીની સંખ્યા					
કાર્યમાલ (જથ્થામાં)					
ચીજ વસ્તુના એક એકમની વેચાણ કિંમત					
એ. અંદાજીત વેચાણ / આવક (કિંમતમાં)					
ઉત્પાદનનું ખર્ચ :					
૧. કાર્યો માલ					
૨. પગાર મજૂરી (ઈ.એસ.આઈ.બોનસ પ્રોવીડંડ વિગેરે) (દરેકના જુદા જુદા આંકડા આપવા)					
૩. લાઈટ / પાવર / બળતણ					
૪. વપરાનાર સ્ટોર્સ					
૫. સમારકામ અને જાળવણી ખર્ચ					
૬. પેકીંગનો ખર્ચ					
૭. ફેક્ટરીનું ભાડું / ટેક્ષ					
૮. મિલ્કતનો ઘસારો					
૯. ફેક્ટરીના પરચુરણ ખર્ચાઓ					
૧૦. આકસ્મિક ખર્ચાઓ					
૧૧.					
૧૨.					
બી. ઉત્પાદનનું એકંદર ખર્ચ (૧ થી ૧૨)					

વિગત	પહેલું વર્ષ	બીજું વર્ષ	ત્રીજું વર્ષ	ચોથું વર્ષ	પાંચમું વર્ષ
સી. કાચો નફો : (એ - બી)					
ઈતર ખર્ચ :					
૧. વેચાણ માટેનું ખર્ચ					
૨. તાંત્રીક જાણકારી અને રોયલ્ટીનું ખર્ચ					
૩. વહીવટી ખર્ચ					
૪. એકસાઈઝ ડ્યુટી					
૫. મુદતી લોન ઉપર વ્યાજ					
૬. બેંક પાસેથી લીધેલી લોન ઉપર વ્યાજ					
૭. બજારમાંથી મેળવેલ કરજ ઉપર વ્યાજ					
૮. કામકાજની મૂડી માટેની લોન ઉપર વ્યાજ					
૯.					
૧૦.					
ડી. ઈતર એકંદર ખર્ચ (૧ થી ૧૦)					
ઈ. ઉત્પાદન અને ઈતર એકંદર ખર્ચ (બી + ડી)					
એફ. કામકાજમાંથી મળતો ચોખ્ખો નફો (એ - ઈ) ઈન્કમેટેક્સ ચુકવ્યા પહેલાંનો					
બાદ:— ઈન્કમેટેક્સ માટેની જોગવાઈ					
જી. ચોખ્ખો નફો (ઈન્કમેટેક્સ બાદનો)					

:: અર્થશાસ્ત્ર - ૨ ::

॥ कृष्ण - कृष्ण कृष्ण ॥

(252)

[illegible]

[illegible]

:: અનેક્ષર - ૩ ::**:: બેંક ઈવન પોઈન્ટની ગણતરી ::**

(કેપીસીટીના ઉપયોગના _____ % પ્રમાણે _____ વર્ષ _____)

(રકમ રૂ.)

	પહેલું વર્ષ	બીજું વર્ષ	ત્રીજું વર્ષ	ચોથું વર્ષ	પાંચમું વર્ષ
અ. વેચાણની રકમ					
બ. કુલ પરિવર્તનક્ષમ ખર્ચ (૧ થી ૮)					
૧. કાર્યો માલ					
૨. પાવર અને બળતણ					
૩. કામકાજની મૂડી પર વ્યાજ					
૪. સીધી મજૂરી અને પગાર					
૫. વેચાણ ખર્ચ					
૬. પેકીંગનું ખર્ચ					
૭. અન્ય પરચુરણ ખર્ચ					
૮. વપરાનાર સ્ટોર્સ					
ક. વધારો (અ - બ)					
ડ. કુલ સ્થાયી ખર્ચ (૧ થી ૭)					
૧. સમારકામ અને જાળવણી ખર્ચ					
૨. આડકતરા પગારો અને મજૂરી					
૩. ઘસારો					
૪. મધ્યમ મુદતની લોન ઉપર વ્યાજ					
૫. વહીવટી ખર્ચાઓ					
૬. ટેક્ષ અને વીમો					
૭. લાંબી મુદતની લોન ઉપર વ્યાજ					
બેંક ઈવન પોઈન્ટ = $\frac{ડ}{ક} \times ૧૦૦$					

:: અનેક્ષર - ૪ ::**:: ડેબ્ટ સર્વીસ કવરેજ રેશીઓ ::**

(રકમ રૂા.)

અ.નં.	વિગત	પહેલું વર્ષ	બીજું વર્ષ	ત્રીજું વર્ષ	ચોથું વર્ષ	પાંચમું વર્ષ
૧.	ચોખ્ખો નફો / ખોટ					
૨.	લોન ઉપર વ્યાજ					
૩.	ઘસારો					
૪.	સરવાળો (૧ + ૨ + ૩)					
૫.	લોન ઉપર વ્યાજ					
૬.	લોનના હપ્તા					
૭.	સરવાળો (૫ + ૬)					
	એવરેજ ડેબ્ટ સર્વીસ કવરેજ રેશીઓ (૪ ÷ ૭)					
	એવરેજ ડેબ્ટ સર્વીસ કવરેજ રેશીઓ :					